

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટન ઘરેલું હિંસાનો અંત લાવવા જાહેર શિક્ષણ અને જાગૃકતા ઊભી કરવા ભાગીદારો શોધી રહ્યું છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જાન્યુઆરી 29, 2020) – આજે, પોતાની કાઉન્સિલ કમિટીની બેઠકમાં, બ્રેમ્પટન સીટી કાઉન્સિલે પ્રાદેશિક કાઉન્સિલર રોએના સાન્ટોસ (Rowena Santos) દ્વારા મૂકવામાં આવેલા એક પ્રસ્તાવને મંજૂર કર્યો જે પીલ રીજીયનલ પોલીસ, રીજીયન ઓફ પીલ અને સામુદાયિક સંસ્થાઓને બ્રેમ્પટન અને પીલ રીજીયનમાં ઘરેલું હિંસાનો અંત લાવવા જાહેર શિક્ષણ અને જાગૃકતા ઝુંબેશ ચલાવશે.

સપ્ટેમ્બર 2019 માં, બ્રેમ્પટન સીટી કાઉન્સિલે પીલ રીજીયનના ઘરેલું હિંસાથી અસર પામેલા લોકોને સેવાઓ પૂરી પાડતા હાલના કાર્યક્રમોને ટેકો આપવાનું અને રીજીયન સાથે કામ કરવાનું ચાલુ રાખવા સર્વાનુમતે એક પ્રસ્તાવ પસાર કર્યો જેમાં સામેલ છે, પીલ કમિટી અગેઈન્સ્ટ વૂમન એબ્યુઝ (PCAWA), સેફ્ટ સેન્ટર ઓફ પીલ, અને વિક્ટમ સર્વિસીસ ઓફ પીલ.

ગયા વર્ષે, 100 થી વધારે રહેવાસીઓ, સીટી કર્મચારીગણ અને ચૂંટાયેલા અધિકારીઓએ PCAWA ની આગેવાનીમાં સીટી હોલમાં યોજાયેલા એક આયોજન, ટેક બેક ધી નાઈટમાં ભાગ લીધો હતો.

સીટી ઓફ બ્રેમ્પટન રીજીયન ઓફ પીલની આગેવાનીમાં કમ્યુનિટી સેફ્ટી એન્ડ વેલબીંગ સિસ્ટમ લીડરશિપ ટેબલમાં સહભાગી થાય છે. સિસ્ટમ લીડરશિપ ટેબલ રીજીયન ઓફ પીલમાં સમુદાયોની સુરક્ષા અને સુખાકારીને નકારાત્મક રીતે પ્રભાવિત કરતા મુદ્દાઓના મૂળ કારણોને સંબોધે તેવી વ્યૂહરચનાઓ વિકસાવવા અને તેનો અમલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બહુ વિશાળ સમૂહમાં, ફેમિલી વાયોલન્સ એક્શન ટેબલ ઘરેલું હિંસા સહિત ક્રોનિકલ હિંસાનો જટિલ મુદ્દો સંબોધવા કટિબદ્ધ રહ્યું છે.

પીલ રીજીયનલ પોલીસ બ્રેમ્પટનવાસીઓ માટે વિવિધ માહિતી અને સ્થાનિક સંસાધનો પૂરા પાડે છે, જેમાં સામેલ છે: મદદ, આશ્રયસ્થાન, સામુદાયિક સલાહ-મસલત મેળવવા માટેના સુરક્ષિત સ્થળો, કાર્યક્રમો અને સહાયતા સેવાઓ, બાળકો અને વયોવૃદ્ધ વ્યક્તિઓ માટે કાનૂની સંસાધનો અને સહાયતા.

ગત ફેબ્રુઆરી 5, 2020 નાં રોજ કાઉન્સિલની મંજૂરી મળ્યા પછી, આ શહેર આ ઝુંબેશ આગળ વધારવા અને ઘરેલું હિંસાનો અંત લાવવા તરફ કામ કરવા અને તમામ લોકો માટે શહેરને વધારે સુરક્ષિત બનાવવા, રીજીયન ઓફ પીલ, પીલ રીજીયનલ પોલીસ અને સામુદાયિક સંસ્થાઓ સહિતના, સ્થાનિક હિતધારકો સાથે ઘનિષ્ટપણે કામ કરશે.

અવતરણો (ક્વોટ્સ):

“ઘરેલું હિંસાનો અંત લાવવો એ બ્રેમ્પટન સીટી કાઉન્સિલ માટે મહત્વની બાબત છે. કાઉન્સિલ આરોગ્યપ્રદ અને સુરક્ષિત સમુદાય બનાવવા કામ કરે છે ત્યારે, આપણે ઘરેલું હિંસાની જાહેર જાગૃકતા વધારવા, રિપોર્ટિંગને પ્રોત્સાહન આપવા, અને બ્રેમ્પટનવાસીઓના ભાવનાશીલ અને નાણાકીય અત્યાચારનો સામનો કરવા રીજીયનમાં અને પીલ રીજીયનલ પોલીસમાં આપણાં ભાગીદારો સાથે મળીને કામ કરવા વધારે નક્કર કરી શકીએ છીએ.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“ઘરેલું હિંસા બ્રેમ્પટનમાં વધતી જતી સામુદાયિક સુરક્ષા ચિંતા છે. ઘરેલું હિંસાનો સામનો કરવામાં એક ભાગીદાર તરીકે, આ મુદ્દાને પહોંચી વળવા શિક્ષણ અને જાગૃકતા મહત્વની સંચાલન વ્યૂહરચનાઓ છે એટલે જ અમે જાહેર જાગૃકતા ઝુંબેશ વિકસાવવા સંસાધનોને નિર્દેશ આપી રહ્યાં છીએ. ઘરેલું હિંસાને સંબંધિત અત્યાચાર અને મૃત્યુ ચિંતાજનક અને સંપૂર્ણપણે અન્યાયયુક્ત બાબતો છે. અમે દરેક વ્યક્તિ સહાયતા ક્યાંથી મેળવી શકે છે તે તેઓને જણાવવા અને વિસ્તૃત કહેવા ઇચ્છીએ છીએ.”

- *રોએના સાન્ટોસ (Rowena Santos), અધ્યક્ષ, સમુદાય સેવાઓ; પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5, સીટી ઓફ બ્રેમ્પટન*

“મને લાગે છે સીટી ઓફ બ્રેમ્પટન માટે જાગૃકતા ઊભી કરવા અને ઘરેલું હિંસાનો ભોગ બની શકતી વધુ મહિલાઓને સહાયક સંસ્થાઓ આપવા સામુદાયિક સંસ્થાઓ સાથે ભાગીદાર બનવું બહુ મહત્વની બાબત છે.”

- *બલદેવ મુટ્ટા (Baldev Mutta), ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, પંજાબી કમ્યુનિટી હેલ્થ સર્વિસીસ*

“દરેક વ્યક્તિને હિંસા રહિત જીવન જીવવાનો અધિકાર છે. આપણે સૌએ આપણાં સમુદાયમાં મહિલાઓ અને તેઓના બાળકોના જીવનમાં હિંસા દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવવાની છે.”

- *શેરોન ફ્લોયડ (Sharon Floyd), એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ઇન્ટરિમ પોલીસ*

“સીટી ઓફ બ્રેમ્પટન કર્મચારીઓ આ મહત્વના કારણ પ્રત્યે સમર્પિત થવાનું અને ઘરેલું હિંસાનો અંત લાવવા સ્થાનિક હિતધારકો સાથે સહયોગ સાધવાનું ચાલુ રાખ્યું છે. અમે સમુદાય અને અમારા પ્રાદેશિક અને કાયદો અમલબજવાણી ભાગીદારો સાથે આ જાહેર શિક્ષણ અને જાગૃકતા ઝુંબેશ ચલાવીએ છીએ ત્યારે, અમે કમ્યુનિટી સેફ્ટી એન્ડ વેલબીંગ સિસ્ટમ લીડરશિપ ટેબલ મારફતે પહેલેથી ચાલી રહેલું મહત્વનું કામ વિસ્તારી રહ્યાં છીએ.”

- *ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન*

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca